

એન.એ./શરતભંગ/એસ.આર./૮૭/૨૦૧૪-૨૦૧૫
નં. બીનખેતી/ક.૬૭/વશી/૫૬૪/૨૦૧૪
કલેક્ટર કચેરી, બિનખેતી શાખા, વડોદરા
તા.૨૬/૦૮/૨૦૧૪

// વાંચ્યા //

૧. અરજદાર શ્રી અશોકકુમાર ગોરધનભાઈ પટેલ ની મોજે- અટલાદરા તા.વડોદરાના સ.નં.૨૬૦ પૈકી, સી.સ.નં.૧૦૩૨/અ ની ૨૩૩.૩૧ ચો.મી. બીનખેતીની જમીનમાં વાણિજ્ય હેતુ માટે રીવાઈઝ બીનખેતીની પરવાનગી મળવા બાબતની તા.૧૮/૦૩/૨૦૧૪ ની અરજી
૨. અત્રેના હુકમ નં.એન.એ./એસ.આર./૧૩૨/૨૦૦૧-૦૨ નં. જમીન/ડી/વશી/૨૦૮૩/૨૦૦૨ તા.૦૪/૦૮/૨૦૦૨
૩. જમીન મહેસુલ કાયદાની કલમ-૬૫/એ, ૬૭ તથા ૬૭/એ
૪. જમીન મહેસુલ નિયમોના નિયમ-૧૦૦
૫. ગુજરાત સરકાર, મહેસુલ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક/બખપ/૧૦૦૬/૪૨૫/ક તા.૧/૭/૨૦૦૮
૬. સરકારશ્રીના મહેસુલ વિભાગના તા.૭/૮/૮૮ના પરીપત્ર અન્વયે જમીન ધારકશ્રીએ રજુ કરેલ તા.૨૪/૦૬/૨૦૧૩ નું સોગંદનામું
૭. વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ ના પત્ર નં.યુડીએ/પ્લાન-૨/૫૩૬/૨૦૧૪ તા.૧૧/૦૪/૧૪ થી રજુ થયેલ ઝોન અંગેનો અભિપ્રાય.
૮. સર્કલ ઓફિસરશ્રી, બિનખેતી, વડોદરા શહેર ના પત્ર નં.સ.ઓ./એસ.આર./૧૦૩/૨૦૧૩-૧૪ નં.સ.ઓ/વશી/૧૮૧/૨૦૧૪ તા.૨૬/૦૫/૨૦૧૪ થી રજુ થયેલ દરખાસ્ત
૯. તા.૩૦/૦૬/૨૦૧૪ ના નોંધપરના આદેશ અનુસાર

// હુકમ //



- મોજે- અટલાદરા તા.વડોદરાના સ.નં.૨૬૦ પૈકી, સી.સ.નં.૧૦૩૨/અ ની ૨૩૩.૩૧ ચો.મી. જમીન શ્રી અશોકકુમાર ગોરધનભાઈ પટેલ ના ખાતે ચાલે છે.
- સવાલવાળી જમીનની રહેણાંક હેતુ માટે બિનખેતીની પરવાનગી ઉક્ત વંચાણ(૨) ના હુકમ અન્વયે આપવામાં આવેલ છે.
૩. ઉક્ત બિનખેતીની ૨૩૩.૩૧ ચો.મી. જમીનમાં વાણિજ્ય ના હેતુ માટે રીવાઈઝ બીનખેતી ની પરવાનગી મેળવવા અરજદારે વંચાણ (૧) માં દર્શાવેલ અરજીથી માંગણી કરેલ છે.
 ૪. વાણિજ્ય ના બાંધકામ માટે વડોદરા મહાનગર સેવા સદનની સ્કીમની ફી ની પાવતી નં.૧૨૧૦૧૬-ટીડી૦૩-૦૦૦૬ તા.૧૬/૧૦/૨૦૧૨ રજુ કરેલ છે. તથા વડોદરા મહાનગર સેવા સદનની રજાચિઠ્ઠી નં.વોર્ડ-૬/કોમ+રેસી/૫૦/૨૦૧૩-૧૪ તા.૧૫/૦૬/૨૦૧૩
 ૫. અરજદારે મહેસુલ વિભાગ ગાંધીનગરના પરીપત્ર તા.૭/૮/૮૮ અન્વયે નિયત નમુનામાં સોગંદનામું તા.૨૪/૦૬/૨૦૧૩ નું રજુ કરેલ છે. તેમાં તેઓએ આ અંગે ઉપસ્થિત થનાર સઘળી જવાબદારી અદા કરવા બાંહેધરી આપેલ છે. અને રાજ્ય સરકારશ્રીની કોઈ જવાબદારી રહેશે નહીં તેવું જણાવેલ છે.
 ૬. વડોદરા શહેરી વિકાસ સત્તામંડળના વંચાણ-૭ ના પત્રથી જણાવ્યા મુજબ મોજે-અટલાદરા, તા.જી.વડોદરાના રે.સ.નં.૨૬૦ +(૨૬૬) વાળી જમીન સરકારશ્રીના મંજૂર અને હાલ અમલી ધ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના મુજબ રહેણાંક ઝોન (આર.આર.આર.) માં આવે છે. તથા સુચિત ૩૦.૦ મીટરનો રસ્તો પસાર થાય છે. આથી જી.ડી.સી.માં જોડાઈ ઝોનીંગ રેગ્યુલેશન મુજબ સવાલવાળી જમીનમાં વાણિજ્ય હેતુ માટે રીવાઈઝ બિનખેતીની પરવાનગી આપવામાં આવે તો ઝોનીંગ દ્રષ્ટિએ વાંધા સરખું નથી, તેમ જણાવેલ છે.

૭.

સામલતદારશ્રી, બિનખેતી વડોદરા(શ) ના સર્કલ ઓફિસરશ્રીએ તપાસ કરી વંચાણ-૮ માં દર્શાવેલ પત્ર થી રજુ કરેલ અહેવાલ/અભિપ્રાય મુજબ મોજે- અટલાદરા તા.વડોદરાના સ.નં.૨૬૦ પૈકી, સી.સ.નં.૧૦૩૨/અ ની ૨૩૩.૩૧ ચો.મી. બિનખેતીની જમીનનો ઉક્ત વંચાણ(૨) નો હુકમ સવાલવાળી જમીનમાં રહેણાંક હેતુ માટે ઉપયોગ કરવા માટેનો છે. જે હુકમોની શરતોનો ભંગ થયેલ છે. શરતભંગ થયેલાનું અરજદારે પણ કબુલ કરેલ હોઈ, આ કામે વાણીજ્ય હેતુ માટેના રૂા.૦.૬૦ પ્રમાણે થતાં પ્રવર્તમાન દરે વિ.ધારો તથા તે ઉપરના અન્ય ઉપકરો તથા નિયત દંડ વસુલ લઈ બિનખેતીની રીવાઈઝ પરવાનગી આપવા ભલામણ કરેલ છે. માહે જુન-૨૦૧૩ થી બાંધકામ ચાલુ છે.

૮. મોજે- અટલાદરા તા.વડોદરાના સ.નં.૨૬૦ પૈકી, સી.સ.નં.૧૦૩૨/અ ની ૨૩૩.૩૧ ચો.મી. જમીન અંગે હકક પત્રકમાં નીચે મુજબની ફેરફારનોંધો પડેલ છે.

ક્રમ	નોંધ નંબર	તારીખ	નોંધની ટુંકી વિગત
સ.નં.૨૬૦ ક્ષે(એ.૩-૧૮ગું)			
૦૧	૧૪૦		વારસાઈ ની નોંધ
૦૨	૬૨૩	૨૨/૦૮/૫૯	કે.જે.પી ની નોંધ
૦૩	૮૮૩	૧૫/૦૪/૬૪	આકામાં ઘટાડા ની નોંધ
૦૪	૯૯૦	૧૫/૦૪/૬૬	વારસાઈ હકક ની નોંધ
૦૫	૧૬૨૬	૦૪/૦૮/૮૨	વારસાઈ ની નોંધ
૦૬	૧૬૨૭	૦૪/૦૮/૮૨	નામ દાખલ ની નોંધ જે "રદ" થયેલ છે.
૦૭	૧૮૦૩	૧૦/૧૧/૮૭	સહ નામો દાખલ ની નોંધ જે "રદ" થયેલ છે.
૦૮	૧૮૨૮	૨૫/૦૫/૮૮	વારસાઈ ની નોંધ
૦૯	૨૦૩૬	૧૫/૦૩/૮૬	હુકમ ની નોંધ
૧૦	૨૦૭૩	૧૮/૧૦/૮૫	વીલ આધારે વારસાઈ ની નોંધ જે "રદ" થયેલ છે.
૧૧	૨૦૯૮	૧૮/૦૨/૮૭	વારસાઈ ની નોંધ
૧૨	૨૧૬૦	૦૪/૧૨/૮૭	હુકમથી બી.ખે વેચાણની નોંધ
૧૩	૨૧૭૦	૩૧/૧૨/૮૭	હુકમથી બી.ખે. વેચાણ ની નોંધ
૧૪	૨૧૭૭	૩૧/૧૨/૮૭	હુકમથી બી.ખે. વેચાણ ની નોંધ
૧૫	૨૧૭૮	૩૧/૧૨/૮૭	હુકમથી બી.ખે. વેચાણ ની નોંધ
૧૬	૨૩૨૦	૨૧/૦૬/૮૮	યુ.એલ.સીહુકમ ની નોંધ
૧૭	૨૩૨૩	૨૧/૦૬/૮૮	નામ કમી ની નોંધ
૧૮	૨૩૫૦	૨૮/૧૦/૮૮	વેચાણ ની નોંધ
૧૯	૨૪૨૮		લાગુ પડતી નથી
૨૦	૨૪૮૦	૦૫/૦૩/૦૧	બી.ખે.વેચાણ ની નોંધ
સીટી સર્વે પ્રોપર્ટીકાર્ડમાં નીચે મુજબની નોંધ થયેલ છે.			
સી.સ.નં.૧૦૩૨/અ			
૨૧	૮૪૭૧/૪૬૮	૦૪/૦૬/૧૧	રજી.વેચાણ ની નોંધ

ખાતેદારે બિનખેતીના વાણિજ્ય હેતુ માટે રૂ.૩૩.૩૧ ચો.મી. ના રૂ.૩૦/- ના દરે ભરવાપાત્ર રૂપાંતરકરની રકમ રૂ.૬,૯૯૯/- (અંકે રૂપિયા છ હજાર નવસો નવ્યાણુ પુરા) તા.૨૪/૦૭/૨૦૧૪ ના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં "૦૦૩૫" સદરે જમા કરાવી અસલ ચલન રજુ કરેલ છે. વિશેષધારાનાં ૪૦ પટ મુજબ ભરવાપાત્ર વાણિજ્ય હેતુ ની ૨(બે) વર્ષ ની દંડની રકમ રૂ.૧૧,૨૦૦/- (અંકે રૂપિયા અગિયાર હજાર બસો પુરા) તથા રહેણાંક હેતુની ૧(એક) વર્ષ ની દંડની રકમ રૂ.૮,૫૨૦/- (અંકે રૂપિયા આઠ હજાર પાંચસો વીસ પુરા) મળી કુલ દંડની રકમ રૂ.૧૯,૭૨૦/- (અંકે રૂપિયા ઓગણીસ હજાર સાતસો વીસ પુરા) તા.૨૪/૦૭/૨૦૧૪ ના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં "૦૦૨૯" સદરે જમા કરાવી અસલ ચલન રજુ કરેલ છે. માપણી ફીની રકમ રૂ.૫,૧૦૦/- (અંકે રૂપિયા પાંચ હજાર એકસો પુરા) તા.૧૬/૦૭/૨૦૧૪ ના રોજ તલાટીશ્રી ની કચેરીમાં જમાં કરાવી પહોચ નંબર-૩૧ રજુ કરેલ છે. વિશેષધારાની રકમ રૂ.૧,૦૫૦/- (અંકે રૂપિયા એક હજાર પચાસ પુરા) તા.૧૪/૦૮/૨૦૧૪ ના રોજ તલાટીશ્રી ની કચેરીમાં જમાં કરાવી પહોચ નંબર-૪૮ રજુ કરેલ છે. શિક્ષણ ઉપકર ની રકમ રૂ.૨૬૦/- (અંકે રૂપિયા બસો સાહીઠ પુરા) તા.૧૪/૦૮/૨૦૧૪ ના રોજ તલાટીશ્રી ની કચેરીમાં જમાં કરાવી પહોચ નંબર-૧૪ રજુ કરેલ છે.

૧૧. મોજે- અટલાદરા તા.વડોદરાના સ.નં.૨૬૦ પૈકી, સી.સ.નં.૧૦૩૨/અ ની રૂ.૩૩.૩૧ ચો.મી. બિનખેતીની જમીનનો વિ.ધારો તારીખ ૦૧/૦૮/૨૦૧૨ થી નવા દર વાણિજ્ય ચો.મી. ના રૂ.૦.૬૦ પ્રમાણે બીજો હુકમ થતા સુધી સામેલ પત્રકમાં જણાવ્યા મુજબ દર વર્ષે ભરવાની શરતે વાણિજ્ય હેતુ માટે રીવાઈઝ બિનખેતીની પરવાનગી આપવા નીચેની વધુ શરતોને આધીન રહીને હુકમ કરવામાં આવે છે.

// શરતો //

૧. વડોદરા મહાનગર સેવા સદનની રજાચિઠ્ઠી નં.વોર્ડ-૬/કોમ+રેસી/૫૦/૨૦૧૩-૧૪ તા.૧૫/૦૬/૨૦૧૩ રજુ કરેલ છે. તે લગત મંજુર થયેલ નકશા મુજબની શરતો અને તે લગત મંજુર થયેલ લેઆઉટ પ્લાન મુજબ બાંધકામ પુરૂ કરવાનું રહેશે. કોઈપણ જાતનું ખુલ્લી જમીનમાં અગર વધારાનું બાંધકામ અગાઉથી વડોદરા મહાનગર સેવા સદનની પરવાનગી મેળવ્યા સિવાય થઈ શકશે નહીં.
૨. અન્ય પ્રવર્તમાન ધારાઓ અંગે પરવાનગી લેવાની થતી હશે તો તે કબજેદારે લેવાની રહેશે.
૩. બાંધકામ પુરૂ કર્યા તારીખથી એક માસમાં અત્રે લેખિત જાણ કરવી પડશે.
૪. આ જમીન ઉપરનું મંજુર થયા પ્રમાણેના પ્લાન મુજબ બાંધકામ આ હુકમ થયા તારીખથી છ માસમાં શરૂ કરી ત્રણ વર્ષમાં પુરૂ કરવાનું રહેશે. તેમ કરવા ચુક થયે પરવાનગી આપોઆપ રદ થયેલી ગણાશે અને વસુલ ભરેલ વિ. ધારો વગેરે કોઈપણ પરત મેળવવાનો હકક રહેશે નહીં. આ અંગે અપીલનો સમય પુરો થયા બાદ કોઈ હકક રહેશે નહીં.
૫. રજાચિકી કે લેઆઉટ પ્લાન વિરૂધ્ધ બાંધકામ થયાના પ્રસંગે કલેક્ટરશ્રી આપે તે સમયમાં દુર કરવાનું રહેશે અને વિરૂધ્ધ વર્તન થયાના પ્રસંગે કબજેદારને ખર્ચે દુર કરવા અને ખર્ચે જમીન મહેસુલ બાકી રાહે વસુલ કરવાપાત્ર થશે અને કલેક્ટરશ્રી ઠરાવે તે દંડ ભરવો પડશે.
૬. હુકમ થયા તારીખથી ૬ માસની અંદર સોસાયટી કબજેદારે જમીન મહેસુલ કાનુનમાં જણાવ્યા મુજબ નમુના 'એમ' માં સનદ ભરીઆપવાની રહેશે તે વિરૂધ્ધ વર્તન થયાના પ્રસંગે કલેક્ટરશ્રી

ઠરાવે તે દંડ ભરવાનો રહેશે. ઉક્ત સનદ અપીલનો સમય પુરો થયા બાદ ભરી આપવાની રહેશે.

૭. જે બાંધકામ કરવામાં આવે તેવા તુર્તજ સળગી ઉઠે તેવા સ્કોટક પદાર્થ રાખી શકાશે નહીં.
૮. સહીયારા/ કોમન પ્લોટ અને રસ્તાની જમીન સોસાયટીની સહીયારી માલીકીની અથવા સર્વે પ્લોટની સહીયારી માલીકીની ગણાશે તે ઉપર મુળ માલીકનો હક્ક રહેશે નહીં.
૯. બાંધકામના નિયમોની જોગવાઈ પ્રમાણે સોસાયટીના સહીયારા ઉપયોગ માટે કલબ, ઓફિસરોના મકાનો, સહકારી ભંડાર બાંધવા કોમન પ્લોટના ૧/૬ જેટલા ભાગના ક્ષેત્રફળમાં બાંધકામ કરવા પ્લોટ હોલ્ડર ઈચ્છે તો મંજૂરી મેળવી તેમ કરી શકશે.
૧૦. ઉપર (૯)માં જણાવ્યા સિવાયના કોઈપણ હેતુ માટે તે સાર્વજનિક ઉપયોગ હોય તો પણ કોમન પ્લોટમાં બાંધકામ કરી શકશે નહીં.
૧૧. રસ્તા અને કોમન પ્લોટની જમીનનું હરાજીથી, બક્ષીસથી કે અન્ય કોઈ રીતે વેચાણ કે તબદીલ થઈ શકશે નહીં.
૧૨. સાર્વજનિક પ્લોટ/રસ્તા સહીતની સમગ્ર જમીનનો બિનખેતી આકાર પ્લોટો વેચાણ કરવામાં આવે ત્યાં સુધી મુળ ખાતેદારે અને પ્લોટો વેચાણ કર્યાથી તમામ પ્લોટ હોલ્ડરોએ પ્રમાણસર ભરવાની રહેશે.
૧૩. કોમન પ્લોટ /રસ્તાની જમીનનું રાજનામું આપે ત્યારે બિનખેતી આકાર કમી કરવાનો થાય છે. તેમ છતાં રસ્તા અને કોમન પ્લોટનો ઉપયોગ તો સોસાયટીના રહીશોએ જ સહીયારો કરવાનો રહેશે.
૧૪. કોમન પ્લોટ તથા ખુલ્લી રાખવાની જગ્યામાં બાંધકામ થઈ શકશે નહીં.
૧૫. આ જમીનનો વાણીજ્ય હેતુ સિવાય અન્ય ઉપયોગ અંગાઉથી કલેક્ટરશ્રી પરવાનગી મેળવ્યા સિવાય થઈ શકશે નહીં તે વિરુદ્ધ વર્તન થવાના પ્રસંગે લે. રે. કોડની કલમ-૬૭ મુજબ પગલા લેવામાં આવશે.
૧૬. આ જમીનનો વિ.ધારો તારીખ ૦૧/૦૮/૨૦૧૨ થી નવા વાણીજ્ય દર ચો.મી. રૂ.૦.૬૦ પ્રમાણે બીજો હુકમ થતા સુધી દર વર્ષે પ્રવર્તમાન દરે તેમજ લોકલ ફંડ તથા શિક્ષણ ઉપકર વિશેષધારા ઉપરાંત ભરવાનો રહેશે. તે અંગે કોઠા રૂપે પત્રક સામેલ છે. તે મુજબ અમલ કરવાનો રહેશે.
૧૭. માપણી જમીનમાં વધ-ઘટ થશે તો તે ઉપરનો વિ. ધારો તથા અન્ય કરો નિયમોનુસાર ભરવો પડશે.
૧૮. કોઈને અડચણરૂપ ન થાય તે રીતે આજુ-બાજુ ખુલ્લી રહેતી જગ્યામાં વૃક્ષારોપણ કરવાનું રહેશે.
૧૯. જમીન ધારકશ્રીએ વરસાદી પાણીના ભુગર્ભ વહન/ સંચય માટે દર મકાન/ બહુમાળી મકાન/ (નક્શા મંજૂર કરવાની સત્તા ધરાવતા સત્તા તંત્રએ આપેલ મંજૂરી મુજબ) દીઠ એકના દરે પરકોલેટીંગ બોરવેલની વ્યવસ્થા અચૂક કરવાની રહેશે.
૨૦. ઉપરની કોઈપણ શરત અગર સનદમાં જણાવેલી શરતો પૈકી કોઈપણ શરતનો ભંગ થયા પ્રસંગે જમીન મહેસુલ કાયદામાં જણાવેલી શિક્ષાને કબજેદાર પાત્ર અને તેનો બાપ લોખા સિવાય કલેક્ટરશ્રી જે પગલાં લેશે તે કબજેદારને બંધનકર્તા રહેશે.

રવાના કર્યું

મામલતદાર (બિનખેતી)
કલેક્ટર કચેરી, વડોદરા.



સહી/-
(વિનોદ રાવ)
કલેક્ટર, વડોદરા

રૂજ. પો. એડી. થી

શ્રી અશોકકુમાર ગોરધનભાઈ પટેલ,
એ-૨૭, મેબલ સોસાયટી, વ્રજધામ મંદીર પાસે,
મોજલપુર, વડોદરા.

૧. નકલ રવાના :

મામલતદારશ્રી વડોદરા શહેર તરફ (૨ પ્રતમાં)

એક પ્રત તાલુકા નમુના નં. ૪માં ઉપજ તથા દંડની નોંધ કરાવી ગામ દફતરે રાખવા મોકલવા તથા વિ. ધારાની રકમ તારીખ ૦૧/૦૮/૨૦૧૨ થી નવા દર પ્રમાણેના હિસાબો સાધવા તથા ગામે તાલુકા નં. નં.-૨ તથા ૭/૧૨ માં વિ. ધારાની નોંધ કરાવવા અને નિયમ પ્રમાણે આગળની તજવીજ કરવા સારું.

૨. નકલ રવાના :

સિટી સર્વે સુપિશ્રી-૧, વડોદરા તરફ. (કામના કાગળો સહ)

૨/-આગળની યોગ્ય તે ઘટિત કાર્યવાહી થવા સારું.

૩. નકલ રવાના જાણ સારું:- નાયબ કલેક્ટરશ્રી, જમીન સુધારણા શાખા, વડોદરા તરફ...

૪. નકલ રવાના :

સ.ઓ. / સર્વેયર, મામલતદારશ્રી બીનખેતી ની કચેરી, વડોદરા તરફ

૫. નકલ રવાના :

નગર નિયોજકશ્રી, વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ, કારેલીબાગ, વડોદરા તરફ જાણ સારું

૬. નકલ જયભારત સહ રવાના :

મ્યુનિસિપલ કમિશનરશ્રી, વડોદરા મહાનગર સેવાસદન, વડોદરા તરફ.

૭. નકલ રવાના : તલાટીશ્રી, અટલાદરા તરફ જાણ સારું



મોજે- અટલાદરા તા. વડોદરાના સ.નં. ૨૬૦ પૈકી, સી.સ.નં. ૧૦૩૨/અ ની ૨૩૩.૩૧ ચો.મી. બિનખેતીની જમીનમાં વાણીજ્ય હેતુ માટે

રીવાઈઝ બીનખેતીની પરવાનગી આપવા અંગેનું પત્રક

નિયમબધ્ધ કરી આપવાની જમીનનો સર્વે નંબર, ક્ષેત્રફળ તથા કબજેદારનું નામ	જમીનનું ક્ષેત્રફળ	નિયમ મુજબ લેવાનો વિશેષધારા ની રકમ	વસુલ કરવાની વિશેષ ધારા ની રકમ	રૂપાંતરકરની વિગત	લોકલ ફંડની વિગત	શિક્ષણ ઉપકરની રકમ	કોલમ-જેનો વિ.ધારો કર્યો તારીખથી લેવાનો છે, તેની વિગત
૧ મોજે- અટલાદરા તા.વડોદરાના સ.નં. ૨૬૦ પૈકી, સી.સ.નં. ૧૦૩૨/અ ની ૨૩૩.૩૧ ચો.મી. બીનખેતીની જમીન શ્રી અશોકકુમાર ગોરધનભાઈ પટેલ	૨ ૨૩૩.૩૧ ચો.મી.	૩ વાણીજ્ય ના રૂ.૦-૬૦ પૈસા પ્રતિ ચો.મી.	૪ રૂ.૧૪૦/- (અંકે રૂપિયા એક સો ચાલીસ પુરા)	૫ રૂ.૬,૮૮૮/- (અંકે રૂપિયા છ હજાર નવસો નવ્વાણુ પુરા)	૬ રૂ.૭૦/- (અંકે રૂપિયા સિત્તેર પુરા)	૭ રૂ.૩૫/- (અંકે રૂપિયા પાત્રીસ પુરા)	૮ તા.૦૧/૦૮/૨૦૧૨ થી પ્રવર્તમાન દરે જે વધુ હોય તે

નોંધ : રૂપાંતરકરની રકમ રૂ.૬,૮૮૮/- (અંકે રૂપિયા છ હજાર નવસો નવ્વાણુ પુરા) તા.૨૪/૦૭/૨૦૧૪ ના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં "૦૦૩૫" સદરે જમા કરાવી અસલ ચલન રજુ કરેલ છે. વિશેષધારાનાં ૪૦ પટ મુજબ ભરવાપાત્ર દંડની કુલ રકમ રૂ.૧૮,૭૨૦/- (અંકે રૂપિયા ઓગણીસ હજાર સાતસો વીસ પુરા) તા.૨૪/૦૭/૨૦૧૪ ના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં "૦૦૨૮" સદરે જમા કરાવી અસલ ચલન રજુ કરેલ છે.

રવાના કર્યું

(Signature)

મામલતદાર (બિનખેતી)

કલેક્ટર કચેરી, વડોદરા.



સહી/-

(વિનોદ રાવ)

કલેક્ટર, વડોદરા